

પાણીની સલામતીના નિયમો

1. રોકાવ અને વિચારો

શું તમને કોઈ જોખમ દેખાય છે?



2. સાથે રહો

એકલા ન જશો. હંમેશા મિત્ર અથવા પરિવારના સભ્ય સાથે જશો.

3. પાણી પર તરતા રહો

જો તમે પાણીમાં પડી જાઓ તો શાંત રહો અને પાણી પર તરતા રહો.



4. 999 અથવા 112 પર કૉલ કરો

જો તમે કોઈને મુશ્કેલીમાં જુઓ તો મદદ માટે કૉલ કરો.